

05 સપ્ટેમ્બર 2018

મતદાનના દિને સમય બચાવવો છે? અત્યારે જ મતદાર યાદી ચકાસી લો.

બ્રમ્પટન, ઓન્ટારિયો – તમામ લાયકાત ધરાવતા મતદારોને સીટી ઓફ બ્રમ્પટન ખાતરી કરી લેવા જણાવે છે કે તેઓ મતદાર યાદીમાં નોંધાયેલ હોય. 2018 બ્રમ્પટન નગરપાલિકા ચૂંટણીમાં મતદાન કરવા માટે લાયકાત ધરાવતા મતદારો મતદાર યાદીમાં અવશ્ય હોવા જોઈએ.

પ્રક્રિયા સરળ છે. [સીટીની વેબસાઈટ](#)ની મુલાકાત લો, “શું હું મતદાર યાદીમાં છું” પર ક્લિક કરો અને યાદી પર તમે છો કે કેમ તે ચકાસવા માટે તમારું નામ, જન્મની તારીખ અને સરનામું દાખલ કરો. જો તમારું નામ યાદીમાં ન હોય તો તમે ઓનલાઈન તમારી માહિતી અપડેટ કરી શકો છો કે તેની ખરાઈ કરી શકો છો અથવા ઉમેરો કરાવવા નોંધણી કરાવી શકો છો. ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલેકે નોંધણી 13 ઓક્ટોબર, રાત્રે 11:59 સુધી થઈ શકશે.

લાયકાત ધરાવતા મતદારો સીટી હોલ ખાતે આવેલ સીટી ક્લર્કના કાર્યોલયની મુલાકાત પણ તે ચકાસવા માટે લઈ શકશે કે શું તેઓ મતદાર યાદીમાં છે કે કેમ અને જો આવશ્યક હોય તો મતદાર યાદીમાં સુધારો કરવા માટેની અરજીનું પત્રક ભરી શકશે. મતદારો મતદાનના દિવસે અથવા કોઈ પણ એડવાન્સ વોટિંગ લોકેશન પર પણ પત્રક ભરી શકશે.

“એક અદ્યતન મતદાર યાદી હોવી તમામ મતદારો માટે લાભદાયી છે. તે મતદારોનો સમય બચાવે છે અને મતદાન પ્રક્રિયા સરળતાથી પાર પડી શકે છે,” એવું 2018 બ્રમ્પટન નગરપાલિકા ચૂંટણીના સીટી ક્લર્ક એન્ડ રિટર્નિંગ ઓફિસર એટલેકે નિર્વાચન અધિકારી, પીટર ફે (Peter Fay) એ જણાવ્યું હતું. “હું એવા તમામ લાયકાત ધરાવતા મતદારોને વિનંતી કરું છું – જેમણે અગાઉની ચૂંટણીમાં મતદાન કર્યું હોય, જેઓ તાજેતરમાં જ બ્રમ્પટન ખાતે નિવાસ કર્યો હોય, અથવા જેઓ ઓક્ટોબર 22 પહેલા ઉંમરના 18 વર્ષ પૂર્ણ કરતા હોય – કે તેઓ ચકાસી લે કે શું તેઓ મતદાર યાદીમાં છે કે કેમ.”

જો તમે કેનેડાના નાગરિક હોવ, મતદાનના દિવસે ઓછામાં ઓછા 18 વર્ષની વયના હોવ, અને બ્રમ્પટનમાં નિવાસ કરતા હોવ (અથવા તમે કે તમારા સાથીદાર બ્રમ્પટન ખાતે મિલકતના ભાડૂત અથવા માલિક હોય).

લિંક:

- [મતદાર યાદીમાં તમે છો કે કેમ તે ચકાસો](#)
- [મતદાન વિષયક 5 અગત્યના મુદ્દાઓ](#)
- પ્રોક્સી મતદાન વિશે વધુ માહિતી સીટીની [વેબસાઈટ](#) પર ઉપલબ્ધ થશે.

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડિયા સંપર્ક :

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા રિલેશન્સ

સીટી ઓફ બ્રામ્પટન

905.874.3654 | natalie.stogdill@brampton.ca